



सत्यमेव जयते

જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી

ક્રમાંક/જિ.ર.ગ.અ./૨૦૧૮-૧૯/રા.ક/

જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી

= સી = બ્લોક, છઠ્ઠો માળ, સહયોગ સંકુલ

સેક્ટર-૧૧, ગાંધીનગર.

ફોન નં: ૦૭૯ ૨૩ ૨૪૦૩૨૪, ૯૨૨૮૪૧૦૧૦૧

તારીખ : ૨૨/૧૦/૨૦૧૭

Dsogandhinagarcity15@gmail.com

સુધારો

પ્રતિ,

જિલ્લા રમતગમત અધિકારીશ્રી, તમામ

ગુજરાત રાજ્ય.

વિષય :- ખેલમહાકુંભ-૨૦૧૮ રાજ્યકક્ષાની સાયકલીંગ ઓપન એજગ્રુપ ભાઈઓ / બહેનોની સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ બાબત.

શ્રીમાન,

સવિનય ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે ખેલમહાકુંભ- ૨૦૧૮ અંતર્ગત રાજ્યકક્ષા સાયકલીંગ ઓપન એજગ્રુપ ભાઈઓ / બહેનો સ્પર્ધાનું આયોજન તા. ૦૩/૧૧/૨૦૧૮ થી તા. ૦૪/૧૧/૨૦૧૮ દરમ્યાન આ સાથે સામેલ કાર્યક્રમ મુજબ થનાર છે. જે અંગેની આપના જિલ્લાની એન્ટ્રી અત્રેના ઈ.મેઈલ આઈ-ડી dsogandhinagarcity15@gmail.com ઉપર તા. ૦૧/૧૧/૨૦૧૮ સુધીમાં મોકલી આપવા વિનંતી. અને ભાગ લેનાર ખેલાડીઓને આ સાથે સામેલ કાર્યક્રમ મુજબ જાણ કરી સ્પર્ધામાં ભાગ લેવા મોકલવા વિનંતી.

રીપોર્ટીંગ તારીખ ભાઈઓ/બહેનો : ૦૩ નવેમ્બર ૨૦૧૮ ના સાંજે ૦૫:૦૦ કલાકે

રીપોર્ટીંગ નિવાસ સ્થળ ભાઈઓ : બોરીજ ભવન ટ્રસ્ટ, અક્ષરધામ મંદિરની સામે, બોરીજ, ગાંધીનગર

સંપર્ક નંબર :- લાભુભાઈ દેસાઈ :- ૯૬૮૭૧૩૩૦૩૭ , ૮૪૯૦૮૧૪૩૨૫

રીપોર્ટીંગ નિવાસ સ્થળ બહેનો : પી.કે.ચૌધરી કોલેજ, પથીકાશ્રમ બસ સ્ટેન્ડની સામે, સેક્ટર-૭, ગાંધીનગર

સંપર્ક નંબર :- વિનુભાઈ ચૌધરી :- ૯૪૨૮૩૮૯૯૬૩

સ્પર્ધા તારીખ : ૦૪ નવેમ્બર ૨૦૧૮ સમય સવારે : ૦૬:૦૦ થી ૧૧:૦૦

સ્પર્ધા સ્થળ ભાઈઓ / બહેનો : ગીફ્ટ સીટી, રાંદેસણ રોડ, ગાંધીનગર

સ્પર્ધા સંપર્ક નંબર : ૧) જીતેન્દ્ર પટેલ (પ્રાંત યુવા વિકાસ અધિકારી) : ૭૫૬૭૯ ૧૩૮૫૮

૨) દિગ્વીજયસિંહ ઝાલા (જી.કલાર્ક) : ૮૮૬૬૩૦૩૧૫૭

નોંધ :- પી.કે.ચૌધરી કોલેજ જવા માટે ગાંધીનગર એસ.ટી.સ્ટેન્ડ ઉતરવું ત્યાં સામે કોલેજ હોસ્ટેલ આવેલ છે.

બોરીજ ભવન ટ્રસ્ટ જવા માટે અક્ષરધામ ઉતરવું ત્યાં સામે બોરીજમાં ભવન આવેલ છે.

સ્પર્ધા અંગે જરૂરી સૂચના :-

- (૧) દરેક ખેલાડીની ઓનલાઇન રજીસ્ટ્રેશનની પહોંચ ફરજિયાત સાથે લાવવાની રહેશે. તેમજ ઓનલાઇન આઈ.ડી. નંબર વાળા જ ખેલાડીઓને જ સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે. તેમજ સ્પર્ધા કે સાયકલની વ્યવસ્થા કરીને આવવાનું રહેશે.
- (૨) ભાગ લેવા આવનાર ખેલાડીઓની K.M.K ID વાળી એન્ટ્રી તથા એલીજબીલીટી ફોર્મ જે તે જિલ્લા રમતગમત અધિકારીના સહી સિક્કા કરીને સાથે લાવવાની રહેશે.
- (૩) સ્પર્ધાને અનુરૂપ ગણવેશ પહેરવો ફરજિયાત રહેશે.
- (૪) ભાગ લેનાર ખેલાડીઓએ ફરજિયાત પણે પોતાની શાળાનું બોનાફાઇડ પ્રમાણપત્ર / આધારકાર્ડ / જન્મ તારીખનો દાખલો / રહેઠાણ / ફોટો આઈ.ડી અને બેન્ક એકાઉન્ટની માહિતી ના જરૂરી પુરાવા સાથે લાવવાના રહેશે.
- (૫) સ્પર્ધા નિવાસ સ્થળે શિસ્તબદ્ધ રીતે વર્તવાનું રહેશે. તેમજ સ્પર્ધા સ્થળે/ નિવાસ સ્થળે કોઈપણ પ્રકારનું નુકશાન કરવામાં આવશે તો તે નુકશાનની પુરેપુરી રકમ જે તે ખેલાડી/ મેનેજરે ભરપાઈ કરવાની રહેશે.
- (૬) સ્પર્ધા પુર્ણ થયે ટીમોએ તાત્કાલિક પરત જવાનું રહેશે અને નિવાસ ખાલી કરવાનો રહેશે.
- (૭) જે તારીખે જે વયગ્રુપની સ્પર્ધા હોય તેમને જ આવવાનું રહેશે. અન્યથા નિવાસ-ભોજનની વ્યવસ્થા જાતે જ કરવાની રહેશે.
- (૮) કોચ કમ મેનેજર સિવાય ખેલાડીઓ સાથે આવનાર વાલી કે શિક્ષકને કોઈપણ જાતની વ્યવસ્થા આપવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.
- (૯) સ્પર્ધામાં આવનાર સાંજે રીપોર્ટિંગ કરનાર તમામ ટીમો માટે બપોર બાદ સાંજથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે.
- (૧૦) ખેલાડી/ મેનેજરે પોતાની સાથે કોઈપણ કિંમતી વસ્તુ લાવવી નહીં નહિતર જવાબદારી ખેલાડી/ મેનેજરની રહેશે.
નોંધ :- પ્રવાસ ખર્ચના નાણાં મેનેજરના બેન્ક ખાતામાં અથવા ચેકથી ચુકવવામાં આવશે. જેથી બેન્ક એકાઉન્ટની વિગતો સાથે લઈને આવવી. જેની ખાસ નોંધ લેવી.

જિલ્લા રમતગમત અધિકારી
ગાંધીનગર

સવિનય નકલ રવાના જાણ સારૂ :-

- ૧) માન. સચિવશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર
- ૨) માન. કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર
- ૩) માન. ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર.
- ૪) માન. કમિશનરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર
- ૫) માન. કલેક્ટરશ્રી, ગાંધીનગર
- ૬) માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ગાંધીનગર
- ૭) માન. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, ગાંધીનગર
- ૮) માન. રીજીયોનલ ડાયરેક્ટરશ્રી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા, સેક્ટર-૧૫, ગાંધીનગર.
- ૯) માન. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, ગાંધીનગર
- ૧૦) માન. નાયબ માહિતી નિયામકશ્રી, ગાંધીનગર, સ્પર્ધાની બહોળી પ્રસિધ્ધિ કરવા સારૂ.
- ૧૧) સિનિયર કોચશ્રી તમામ ગુજરાત રાજ્ય.
- ૧૨) નોડલ અધિકારીશ્રી, ખેલ મહાકુંભ ૨૦૧૮, સાયકલીંગ રાજ્યકક્ષા સ્પર્ધા.
- ૧૩) પ્રમુખશ્રી / મંત્રીશ્રી ગુજરાત રાજ્ય સાયકલીંગ એસોસિએશન.
- ૧૪) ટ્રસ્ટીશ્રી / આચાર્યશ્રી પી.કે.ચૌધરી કોલેજ, મેનેજરશ્રી બોરીજ ભવન.